



SEC/1112/2025

**By E-Filing**

December 11, 2025

National Stock Exchange of India Limited "Exchange Plaza", C-1, Block G, Bandra- Kurla Complex, Bandra (E), Mumbai – 400 051. Scrip Symbol : APARINDS <b>Kind Attn.: Listing Department</b>	BSE Limited Corporate Relations Department, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai - 400 001. <b>Scrip Code : 532259</b> <b>Kind Attn. : Corporate Relationship Department</b>
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------	--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

**Subject: Intimation under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time - Newspaper Publication for publicizing special window for Re-lodgement of Transfer Requests of physical shares. Ref.: SEBI Circular no. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July 2, 2025**

Dear Sir/Madam,

In accordance with SEBI circular no. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July 2, 2025, a special window has been opened for re-lodgement of transfer deeds which were lodged prior to the deadline of April 01, 2019 and rejected/returned/not attended to due to deficiency in the documents/process/or otherwise and who missed re-lodging their requests before the cut-off date of March 31, 2021, are now granted one more opportunity to re-lodge their transfer requests.

In view of aforesaid, the Company has published details in the Business Standard and Vadodara Samachar (the Newspapers) on December 10, 2025 and submitting the same to the Exchanges for record and dissemination.

The aforesaid submission is being made in terms of Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, as amended from time to time.

This is for your information and records.

Thanking You.

Yours faithfully,  
**For APAR Industries Limited**

**Sanjaya Kunder**  
**Company Secretary**

Encl. A/a

APAR Industries Limited

Corporate Office : **APAR House, Corporate Park, V. N. Purav Marg, Chembur, Mumbai - 400 071, India**

**+91 22 4957 2100/6780 0400 corporate@apar.com www.apar.com**

Regd. Office: **301/306, Panorama Complex, R. C. Dutt Road, Alkapuri, Vadodara - 390007, India**

**+91 265 6178740/2339906apar.baroda@apar.com www.apar.com CIN: L91110GJ1989PLC012802**



**RANE HOLDINGS LIMITED**  
(Corporate Identification Number: L35999TN1936PLC002202)  
Registered Office: "Maithri", No. 132, Cathedral Road, Chennai - 600 086  
[e-mail: investorservices@ranegroup.com] [Website: www.ranegroup.com]  
[Tel: 044-28112472 / 73]

**Special Window for Re-lodgement of Transfer Requests for Physical Shares**

Pursuant to the SEBI Circular No: SEBI/HO/MIRSD/ MIRSD-PoD/P/CIR/2025/97 dated July 02, 2025 all shareholders are hereby informed that a Special Window is open upto January 06, 2026, to facilitate re-lodgement of transfer request of physical shares.

This facility is only available for transfer deeds lodged prior to April 01, 2019 and which were rejected, returned or not attended due to deficiencies in documents / process / otherwise.

Investors are encouraged to take advantage of this opportunity by furnishing the necessary documents to the Company's Registrar and Share Transfer Agent i.e. Integrated Registry Management Services Private Limited at 2<sup>nd</sup> Floor, "Kences Towers", No 1, Ramakrishna Street, North Usman Road, T.Nagar, Chennai – 600017 and by email to corpseiv@integratedindia.in.

Place: Chennai  
Date: 11.12.2025

For Rane Holdings Limited  
Siva Chandrasekaran  
Company Secretary



**SIL INVESTMENTS LIMITED**  
CIN NO : L17301RJ1934PLC002761  
Regd. Office: Pachpahar Road, Bhawanimandi 326502 (Raj.) Tel No. : (07433)222052/54/82  
Email: investor.grievances@silinvestments.in Website: www.silinvestments.in

**Special Window for Re - Lodgement of Transfer Requests of Physical Shares of SIL Investments Limited**

Pursuant to SEBI Circular SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 02<sup>nd</sup> July, 2025, all the Shareholders of the Company are hereby informed that a Special Window is open for a period of six months, from 07<sup>th</sup> July, 2025 till 06<sup>th</sup> January, 2026 for re-lodgement of transfer requests of physical shares, which were lodged prior to the deadline of 01<sup>st</sup> April, 2019 and rejected / returned / not attended due to deficiency in the documents / process / or otherwise.

Shareholders who have missed the earlier deadline of 31<sup>st</sup> March, 2021 (the cut-off date for re-lodgement of transfer deed) can take this opportunity by furnishing the necessary documents to the Company's Registrar and Transfer Agent - MUFG Intime India Private Limited, C-101, Embassy 247, LBS Marg, Vikhroli (West), Mumbai - 400083, Tel: +918108116767 and email: investor.helpdesk@in.mpms.mufg.com.

Place : Mumbai  
Date: 10<sup>th</sup> December, 2025

For SIL Investments Limited  
Lokesh Gandhi  
Company Secretary and Compliance Officer



**SUTLEJ TEXTILES AND INDUSTRIES LIMITED**  
CIN NO : L17124RJ2005PLC020927 Regd. Office: Pachpahar Road, Bhawanimandi 326502 (Raj.)  
Ph: (07433)222052/54/82 Email: investor.relations@sutlejitextiles.com Website: www.sutlejitextiles.com

**Special Window for Re-Lodgement of Transfer Requests of Physical Shares of Sutlej Textiles and Industries Limited**

Pursuant to SEBI Circular SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 02<sup>nd</sup> July, 2025, all the Shareholders of the Company are hereby informed that a Special Window is open for a period of six months, from 07<sup>th</sup> July, 2025 till 06<sup>th</sup> January, 2026 for re-lodgement of transfer requests of physical shares, which were lodged prior to the deadline of 01<sup>st</sup> April, 2019 and rejected / returned / not attended due to deficiency in the documents / process / or otherwise.

Shareholders who have missed the earlier deadline of 31<sup>st</sup> March, 2021 (the cut-off date for re-lodgement of transfer deed) can take this opportunity by furnishing the necessary documents to the Company's Registrar and Transfer Agent - MUFG Intime India Private Limited, C-101, Embassy 247, LBS Marg, Vikhroli (West), Mumbai - 400083, Tel: +918108116767 and email: investor.helpdesk@in.mpms.mufg.com.

Place: Mumbai  
Date: 10<sup>th</sup> December, 2025

For Sutlej Textiles and Industries Limited  
Sd/-  
Manoj Contractor  
Company Secretary and Compliance Officer



**RISHI LASER LIMITED**  
CIN : L99999MH1992PLC066412  
Registered Office : 612, Vena Kiledar Industrial Estate, 10-14, Pais Street, Bcyulla (West), Mumbai-400 011.  
•Tel. No. (022) 2307 5677 / 2307 4586 •Fax No. (022) 2308 0022  
•Web : www.rishilaser.com •Email : rcl.mumbai@rishilaser.com

**SPECIAL WINDOW FOR RE-LODGE MENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES**

Further to our newspaper advertisement dated 30<sup>th</sup> August, 2025, and as a part of ongoing communications, shareholders are again informed that pursuant to the SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July 02, 2025, in order to facilitate ease of investing for investors and to secure the rights of investors in the securities which were purchased by them, a Special Window has been opened for a period of six months, from 7<sup>th</sup> July, 2025 to 6<sup>th</sup> January, 2026, to facilitate re-lodgement of transfer requests of physical shares. As informed earlier, this facility is only available for transfer deeds that were lodged prior to 1<sup>st</sup> April, 2019 but were rejected/returned / not attended to due to deficiency in the documents / process / or otherwise. During this period, the securities that are re-lodged for transfer (including those requests that are pending with the Company / RTA – Adroit Corporate Services Private Limited - as on date) shall be issued only in demat mode. Due process shall be followed for such transfer-cum-demat requests. A copy of relevant circular and the notice published in respect of the Special Window has also been placed on the website of the company at [www.rishilaser.com](http://www.rishilaser.com).

Eligible shareholders are requested to contact the Company's Registrar and Transfer Agent (RTA) i. e. Adroit Corporate Services Private Limited, 17/20, Jafarbhoy Industrial Estate, 1<sup>st</sup> Floor, Makwana Road, Marol Naka, Andheri (E), Mumbai-400 059, or contact the Company at [investors@rishilaser.com](mailto:investors@rishilaser.com) for further assistance. Eligible shareholders are requested to submit their transfer requests duly complete in all respects on or before the deadline of 6<sup>th</sup> January, 2026.

By order of the Board  
For **Rishi Laser Limited**  
Sd/-  
Vandana Patel  
Company Secretary

Place: Mumbai  
Date : 10.12.2025



**APAR Industries Limited**  
CIN : L91110GJ1989PLC012802  
Registered Office : 301, Panorama Complex, R. C. Dutt Road, Vadodara - 390 007 (Gujarat), India.  
Phone : (+91) (0265) 6178740, 2339906 Website : [www.apar.com](http://www.apar.com) E-mail : [com.sec@apar.com](mailto:com.sec@apar.com)

**NOTICE TO THE SHAREHOLDERS**

**SPECIAL WINDOW FOR RE-LODGE MENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES**

Pursuant to SEBI Circular SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July 2, 2025, shareholders who had lodged their transfer deeds for physical shares prior to the deadline of April 1, 2019 and whose requests were rejected, returned or not attended to due to deficiencies in documents, processes or other reasons and who missed re-lodging their requests before the cut-off date of March 31, 2021 are now granted one more opportunity to re-lodge their transfer requests. **This special window for re-lodgement will be available for six months from July 7, 2025 to January 6, 2026.** During this period, all shares that are re-lodged for transfer (including any pending requests with the listed Company / RTA as of the current date) will be issued only in demat mode. The necessary procedures for transfer-cum-demat requests will be followed.

Accordingly, as requested earlier vide Notice published on July 25, 2025 and October 08, 2025, eligible shareholders are requested to re-submit their transfer requests to our Registrar and Share Transfer Agent, MUFG Intime India Private Limited (formerly Link Intime India Private Limited). Please find their contact details below :

**MUFG Intime India Private Limited**, "Geetakunj" 1, Bhakti Nagar Society, Behind ABS Tower, Old Padra Road, Vadodara - 390 015. (Gujarat) India. Tel. : (+91) (0265) 3566768  
E-mail : [investor.helpdesk@in.mpms.mufg.com](mailto:investor.helpdesk@in.mpms.mufg.com) Website : <https://in.mpms.mufg.com/>

Place : Mumbai  
Date : December 10, 2025

For APAR Industries Limited  
Sanjaya Kunder  
Company Secretary



**FDC LIMITED**  
(CIN: L24239MH1940PLC003176)  
Registered Office: B-8, M.I.D.C. Industrial Estate, Waluj - 431136, Dist. Chhatrapati Sambhaji Nagar, Maharashtra, India.  
Tel. No. +91 240 255 4407, Website: [www.fdcindia.com](http://www.fdcindia.com),  
Email: [contact@fdcindia.com](mailto:contact@fdcindia.com)

**NOTICE OF NEW CORPORATE OFFICE**

We wish to inform all the stakeholders that FDC Limited's new Corporate Office address is as under.

**NEW CORPORATE OFFICE ADDRESS**

**FDC Limited**

**FDC House, C-11 & 12, Dalia Industrial Estate, Oshiwara Village, Off New Link Road, Andheri - West, Mumbai – 400053 Maharashtra, India**

**Board Line Contact: 022-69107100**

# PUBLIC NOTICE OF NON-ASSOCIATION & IMPERSONATION

This Public Notice is issued on behalf of IIFL Capital Services Limited (herein after referred as "IIFLCAPS", Formerly known as IIFL Securities Ltd), a duly registered stock broker with SEBI. Recently, it has come to our notice that some unscrupulous persons claiming to be Priya Desai, Mansi Sampat, Ghoshan Yadav, Ankita Ghosh, Kirta Mehta, Viral Shah & Suraksha and other unknown persons through various social media platforms viz. WhatsApp groups/links, Telegram Channels, Facebook, Instagram channels, etc. ("platforms") falsely impersonating as representatives of IIFLCAPS or being affiliated with IIFLCAPS. They are misusing the Name, Trademark & SEBI Certificate of IIFLCAPS and the name of, Mr. Anand Bathiya, Independent Director, Mr. Shanker Ramrakhiani, the Chief Information Security Officer of IIFLCAPS, Yatin Shah, Director of 360 One VAM Limited, & Raghav Gupta, Joint CEO of Securities & Private Wealth.They are providing unregistered and unregulated fake websites, unregulated trading platforms & mobile applications which resemble or impersonate website/applications of IIFLCAPS and luring to join/create institutional account to get guaranteed/high returns and deceiving public to invest the money, claiming to facilitate pre-IPO subscriptions with false promises of assured profits and offering illegal trading services etc. Apart from the below WhatsApp Group and Mobile numbers, these impostors may be using other channel(s) / platform(s) / mobile number(s) that we are not aware of. The details of WhatsApp Group/Telegram/YouTube Channels/Facebook Post/Instagram Post/Website etc. including but not limited, are as follows:

### WhatsApp/Facebook Groups:

Sr No	Group Name	Sr No	Group Name
1	IIFL CS Pre-IPO .565	4	D06-IIFL Securities Limited
2	IIFL- Private Placement Circle	5	IIFL CS  Pre-IPO  067
3	85IIFL study Group	6	L12-VIP IVI Service Group

### Mobile Numbers:

Sr No	Mobile No	Sr No	Mobile No	Sr No	Mobile No	Sr No	Mobile No	Sr No	Mobile No	Sr No	Mobile No	Sr No	Mobile No
1.	8238349404	8.	7463 046 386	15.	84380 47055	22.	8433930595	29.	8174897062	36.	313767-5880	43.	9081708775
2.	9538807849	9.	96517 19761	16.	74785 78901	23.	447592165772	30.	9840937298	37.	1504373-3088	44.	9601489269
3.	8125023802	10.	866 767 3663	17.	78699 67380	24.	7090282434	31.	9026345546	38.	8125382406		
4.	9538807849	11.	930140060	18.	7995137740	25.	8105772865	32.	9175091366	39.	9619155730		
5.	8125023802	12.	87123 57763	19.	8867427182	26.	8342995901	33.	9175091366	40.	8125242606		
6.	87999 34898	13.	95234 56345	20.	8548003314	27.	7992631458	34.	9843584310	41.	7702342735		
7.	99543 86122	14.	78929 17833	21.	8792394372	28.	918148767691	35.	7736465211	42.	8925396937		

IIFLCAPS unequivocally/emphatically states that we have no association or affiliation or connection with any of the above named impersonators or persons or any such Platforms or any association or tie up with any restaurants or job portal. They are not, neither has ever been, an employee, agent, or representative of IIFLCAPS nor authorized to represent or conduct any business on behalf of IIFLCAPS. Any transactions or communications with them in IIFLCAPS name or with reference to are repudiated by IIFLCAPS.

We caution all members of the public, our clients, and business partners to exercise extreme diligence and follow below advise:

- Beware of emails / whatsapp messages / any other communication impersonating IIFLCAPS / employees of IIFLCAPS and refrain from responding to such emails / whatsapp messages/ communication and not to engage in any transactions or communications with such persons under the assumption that they are affiliated or associated with IIFLCAPS.
- Inform the local police or cybercrime authority about such fraudsters immediately.
- Investors / public are advised to exercise caution and not fall prey to such fraudulent emails/ whatsapp messages/ communication in the name of IIFLCAPS or its officials
- Investors are urged to observe utmost caution, conduct due diligence, and verify the registration status of any entity claiming to be a registered intermediary of IIFLCAPS by reaching out to our

Customer Care- @ 022-40071000 & cs@iifl.com. Our Official website / social media platform are as below:

- Website - [www.iiflcapital.com](http://www.iiflcapital.com)
  - Twitter - <https://x.com/iiflcapital>
  - Facebook - <https://www.facebook.com/IIFLCapital>
  - Instagram - <https://www.instagram.com/iiflcapital/>
  - Youtube - <https://www.youtube.com/@IIFLCapital>
  - LinkedIn - <https://www.linkedin.com/company/iiflcapital/>
  - To check the details of our Authorized Persons (visit <https://www.indiafoline.com/mandatory-display-of-information>).To receive/pay money from/to investors refer to our designated bank accounts named as "client bank accounts"([https://tweeb.indiafoline.com/trade/frmlInformation2customer.aspx?\\_ga=2.147223735.1814325436.1712824035-1508223574.1691810559](https://tweeb.indiafoline.com/trade/frmlInformation2customer.aspx?_ga=2.147223735.1814325436.1712824035-1508223574.1691810559))
  - To receive/pay money from/to investors refer to our designated bank accounts named as "client bank accounts".([https://tweeb.indiafoline.com/trade/frmlInformation2customer.aspx?\\_ga=2.147223735.1814325436.1712824035-1508223574.1691810559](https://tweeb.indiafoline.com/trade/frmlInformation2customer.aspx?_ga=2.147223735.1814325436.1712824035-1508223574.1691810559))
  - Further, as a part of investor awareness and cautioning public at large, Exchange(s) publish and update all issued press releases on its website. You may view / refer the same at below links
- NSE-<https://www.nseindia.com/invest/advisory-for-investors>  
BSE-<https://www.bseindia.com/markets/MarketInfo/MediaRelease.aspx>  
& [https://www.bseindia.com/attention\\_investors.aspx](https://www.bseindia.com/attention_investors.aspx)  
MCX-<https://www.mcxindia.com/media/press-releases>  
NCDEX-<https://www.ncdex.com/media/press-release>  
& <https://www.ncdex.com/investor-awareness/investor-charter>

IIFLCAPS takes these matters very seriously and is committed to protect the public from such fraudulent activities. We strongly advise any individual or entity that has been approached by them to cease all interactions with them immediately and to report such activities to the appropriate authorities. IIFLCAPS shall not be held responsible for any actions, agreements, or representations made by these individuals and or unknown persons and disclaims all liability for any losses, damages, or other consequences resulting from such unauthorized actions by them.

We reserve the right to pursue legal action against such impersonators and any parties found to be complicit in the impersonation and fraudulent activities.

**BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL, BENGALURU BENCH**  
**IN THE MATTER OF SECTION 230 TO 232 READ WITH SECTION 52, SECTION 66 AND OTHER APPLICABLE PROVISIONS OF THE COMPANIES ACT, 2013 AND RULES MADE THEREUNDER AND**  
**IN THE MATTER OF SCHEME OF ARRANGEMENT BETWEEN**  
**FINNOVATION TECH SOLUTIONS PRIVATE LIMITED AND**  
**KRAZYBEE SERVICES LIMITED AND THEIR RESPECTIVE SHAREHOLDERS (THE "SCHEME")**  
**CA(CAA) NO. 43/BB/2025**  
**FINNOVATION TECH SOLUTIONS PRIVATE LIMITED**  
A Company incorporated under the Companies Act, 2013  
Having its registered office at: 4th Floor, Anjaneya Techno Park, No. 147, HAL Old Airport Road, ISRO Colony, Kodihalli, H.A.L. II Stage, Bangalore, Karnataka, India, 560008 CIN: U74900KA2016PTC086953  
.....Applicant Company No. 1 /Transferor Company  
**KRAZYBEE SERVICES LIMITED**  
(Formerly known as Krazybee Services Private Limited)  
A Company incorporated under the Companies Act, 2013  
Having its registered office at: 3rd Floor, No.128/9, Maruthi Sapphire, HAL Old Airport Road, Murugesh Palya, Bangalore, Karnataka, India, 560017 CIN: U65100KA2016PLC086990  
.....Applicant Company No. 2 /Transferee Company  
**ADVERTISEMENT OF NOTICE OF THE HON'BLE NATIONAL COMPANY LAW TRIBUNAL("HON'BLE NCLT") CONVENED MEETING OF THE UNSECURED CREDITORS OF THE TRANSFEROR COMPANY AND THE SECURED CREDITORS AND THE UNSECURED CREDITORS OF THE TRANSFEE COMPANY**  
NOTICE is hereby given that pursuant to original order dated 12 November 2025 read with modified order (the "Order")in the Company Application No. CA(CAA) No. 43/BB/2025, the Hon'ble NCLT, Bengaluru Bench has directed separate meetings to be held of the unsecured creditors of the Transferor Company on Monday, January 12, 2026 at 5:15 P.M. (IST), and the secured creditors of the Transferee Company on Monday, January 12, 2026 at 3:00 P.M. (IST), and the unsecured creditors of the Transferee Company on Monday, January 12, 2026 at 4:00 P.M. (IST), for the purpose of considering, and if thought fit, approving with or without modification, the Scheme of Arrangement between **FINNOVATION TECH SOLUTIONS PRIVATE LIMITED** (the "Transferor Company")and **KRAZYBEE SERVICES LIMITED** (the "Transferee Company") and their respective shareholders under Section 230 to 232 read with Section 52, Section 66 and other applicable provisions of the Companies Act, 2013 and the rules made thereunder.  
In pursuance of the said Hon'ble NCLT Order and as directed therein and in compliance with the applicable provisions of the Companies Act, 2013 (the "Act"), Notice is hereby given that the respective meeting of the unsecured creditors of the Transferor Company,the secured creditors and the unsecured creditors of the Transferee Company will be held through video conferencing ("VC") / other audio visual means ("OAVM"), without the physical presence of the respective creditors of the Transferor Company and the Transferee Company.  
As the meetings are being convened pursuant to Order through VC, physical attendance of the unsecured creditors of the Transferor Company and the secured creditors and the unsecured creditors of the Transferee Company has been dispensed with. Accordingly, the facility for appointment of proxies by the unsecured creditors of the Transferor Company and the secured creditors and the unsecured creditors of the Transferee Company will not be available for the meetings. However, voting through Authorised Representative is permitted.  
If so desired, any person may obtain a physical copy of the Scheme, Explanatory Statement under Sections 230 to 232 read with Section 102 and other applicable provisions of the Act, free of charge on any day (except Saturday, Sunday and public holidays) between 10:00 AM to 6:00 PM from the Registered Office of the Transferor Company and the Transferee Company.  
The Hon'ble NCLT has appointed Mr. Saji P John (Advocate) as the Chairperson of the Meeting, for the meeting of the unsecured creditors of the Transferor Company, the secured creditors of the Transferee Company and the unsecured creditors of the Transferee Company, including for any adjournment(s) thereof. The Hon'ble NCLT has appointed Mr. Sajeewan CV, Former Registrar of Companies of Karnataka and practising Company Secretary, as the Scrutinizer for the aforesaid respective meetings, including for any adjournment(s) thereof. The Scheme, if approved at the respective meetings, will be subject to the subsequent approval of the Tribunal.  
All the unsecured creditors of the Transferor Company and the secured creditors and the unsecured creditors of the Transferee Company are informed that:

- Notice of the aforesaid meetings inter alia including the Explanatory Statement, has been emailed to the unsecured creditors of the Transferor Company and the secured creditors and the unsecured creditors of the Transferee Company, whose names appear in the books of accounts of the Transferor Company and the Transferee Company respectively as on June 30, 2025 at their registered email address. In case of the unsecured creditors of the Transferor Company and the secured creditors and the unsecured creditors of the Transferee Company whose email id is not registered with the Transferor Company and the Transferee Company, the notice shall be served through Registered Post("RPAD") or speed post or courier.
- Pursuant to Hon'ble NCLT Order, the unsecured creditors of the Transferor Company and the secured creditors and the unsecured creditors of the Transferee Company shall have the facility and option of voting on the resolution for approval of the Scheme by casting their votes through (a) remote e-voting which will commence three days prior to the Meeting(s) i.e., from 9:00 a.m. on January 09, 2026 to 5:00 p.m. on January 11, 2026 (b) e-voting during the respective meetings. Also, e-voting will be kept open for 15 minutes after the conclusion of the meeting to enable the secured creditors and the unsecured creditors who have not cast their votes to vote through e-voting system at the meeting. The Company has engaged the services of NSDL for the purpose of providing facility of e-voting for the meetings.
- The result of the voting shall be announced by the Chairman of the meeting in writing upon receipt of the Scrutinizer's Report(s) for each of the meeting. The results announced, along with the Scrutinizer's Report, shall be displayed at the Registered Office of the Transferor Company and the Transferee Company respectively and also be uploaded on the website of the Transferor Company and the Transferee Company respectively, immediately after declaration of the results.
- The necessary instructions for attending the meetings through VC and for e-voting during the meetings have been set out in the notice dated December 10, 2025.
- A Copy of the Notice, Scheme and Explanatory Statement are also available on the website of the Transferee Company and Transferor Company and can be accessed at [www.kbncf.in](http://www.kbncf.in) and [www.kreditbee.in/](http://www.kreditbee.in/) and on the website of BSE at [www.bseindia.com](http://www.bseindia.com) and on the website of NSDL at [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com), being the agency appointed to provide e-voting facilities for the Meetings.
- In case anyone have any queries or issues regarding attending the said VC meeting(s) or e-voting at meeting(s) of the Transferor Company or the Transferee Company, you may contact Secretarial Department, email id: [secretarial@krazybee.com](mailto:secretarial@krazybee.com), email id: [legal@kreditbee.in](mailto:legal@kreditbee.in) respectively.
- Further, the details of helpdesk for any technical issues related to login are provided below:

NCD Holders holding debentures in demat mode with NSDL	E-mail at <a href="mailto:evoting@nsdl.com">evoting@nsdl.com</a> or call on: 022-4886 7000
NCD Holders holding debentures in demat mode with CDSL	E-mail at <a href="mailto:evoting@csdlindia.com">evoting@csdlindia.com</a> or call on :18002109911
Secured and Unsecured Creditors	Email at <a href="mailto:evoting@nsdl.com">evoting@nsdl.com</a> or call on: 022-4886 7000

Date:10 December 2025  
Place:Bengaluru

Saji P John (Advocate)  
Chairperson appointed for the Meeting

